ARVIND FASHIONS LIMITED

A MEMBER OF THE LALBHAI GROUP

Corporate Office: Du Parc Trinity, 8th Floor, 17, M.G. Road, Bengaluru - 560 001 Tel: 91-80-4155 0601, Fax: 91-80-4155 0651 Website: http://www.arvindfashions.com

February 26, 2020

BSE Limited Listing Dept. / Dept. of Corporate Services Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai - 400 001

Security Code: 542484 Security ID: ARVINDFASN National Stock Exchange of India Ltd. Listing Dept., Exchange Plaza, 5th Floor Plot No. C/1, G. Block Bandra-Kurla Complex Bandra (E) Mumbai - 400 051

Symbol: ARVINDFASN

Dear Sir/Madam,

Sub.: Newspaper Advertisement of Notice of Postal Ballot & E-Voting.

Ref: Notice of Postal Ballot of the Company dated February 21, 2020

Pursuant to provisions of Regulation 30 and other applicable regulations of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are submitting herewith the copy of advertisement published in connection with the Notice of Postal Ballot & E-Voting of the Company, in Financial Express (English & Gujarati) on February 26, 2020.

You are requested to kindly take the above information on record.

Thanking you,

Yours faithfully, For Arvind Fashions Limited

Vijay Kumar 8 S Company Secretary

Enclosures: As mentioned above

FINANCIAL EXPRESS

21 of world's 30 most polluted cities in India, says report

AGENCIES New Delhi/Hong Kong February 25

SEVERAL CHINESE CITIES, including Beijing, have dramatically improved their air quality in recent years, while Indian metropolises remain some of the world's worst polluted, according to a new report.

Beijing — once infamous for its toxic haze — has reduced smog levels and dropped down a list of the world's most polluted cities, falling to 199 from 84 three years before, according to the 2019 World Air Quality Re*port* published on Tuesday by IQAir Air Visual. In contrast, India still dominated its list of the smoggiest urban areas, accounting for 14 of the top 20.

Delhi topped the list of most polluted capital cities in the world in 2019, according to the report, which also revealed that 21 of the world's 30 most polluted cities are in India. Despite new government policies meant to address the issue, New Delhi's air quality has fallen from where it was five years ago, rising to the fifth-worst spot globally, the report said. Delhi suburb Ghaziabad is the most polluted city in the world, followed by Hotan in China, Gujranwala and Faisalabad in Pakistan and then Delhi in the fifth place. The 21 Indian cities among the world's 30 most polluted cities, in the order of their ranking, are, Ghaziabad, Delhi, Noida, Gurugram, Greater Noida, Bandhwari, Lucknow, Bulandshahr, Muzaffarnagar, Baghpat, Jind, Faridabad, Coraut, Bhiwadi, Patna, Palwal, Muzaffarpur, Hisar, Kutail, Jodhpur and Moradabad.

India, China and other Asian countries remain disproportionately affected by toxic air as a result of factors ranging from crowded cities, vehicular exhaust, coal-fired power plants, agricultural burning and industrial emissions. The issue is hardly tangential. The WHO estimates that dirty air kills around 7 million people each year, while the World Bank says it drains the



Delhi topped the list of most polluted capital cities in the world in 2019

global economy of \$5 trillion annually. Even before the coronavirus outbreak and trade war slowed China's smog-producing industries, Chinese officials had mobilised the country's topdown, authoritarian state to enforce sweeping measures, as well as shifting production away from its biggest cities. A report from the Centre for Research on Energy and Clean Air separately found that Beijing and Shanghai had seen "major progress," while levels of fine particular called PM 2.5 increased in other parts of

India faces a starkly different situation. Across much of northern India, air quality remains catastrophic as politicians prioritise economic growth and spar over responsibility. Many citizens are still unaware of health concerns and resourcestarved agencies struggle to carry out new — or even existing — measures designed to curb the smog. "In Beijing, it's a priority — in China, when they say something, they do it, they put the resources in," said Yann Boquillod, Air Visual's director of air quality monitoring. "In India, it's just starting. People need to put more pressure on government." A spokesman for India's environment ministry didn't respond to a request for comment.

Although many Indian cities saw progress between 2018 and 2019, "unfortunately these improvements are not representative of the very recent, but promising National Clean Air Programme" and cleaner fuel standards, according to the AirVisual report.

Malaysia's power struggle puts economy's outlook at risk

BLOOMBERG

Kuala Lumpur, February 25

MALAYSIA'S POLITICAL UP-**HEAVAL** is jeopardising the economy's outlook at a time of heightened global risks and brewing discontent among locals about rising living costs.

The ruling coalition collapsed on Monday amid a power

struggle between 94-year-old PM Mahathir Mohamad and his planned successor. The political uncertainty is stalling economic policy, including a stimulus package, due to be unveiled by Mahathir on February 27 to counter coronavirus outbreak.

The set of incentives is set to "go ahead" on a date set by Mahathir as interim premier, after they were finalised by former finance minister Lim Guan Eng on February 23, Lim said in a statement. Earlier, former deputy trade minister Ong Kian Ming cautioned the package wouldn't be announced in time.

"The consequence is that the help that many of the most affected industries would have gotten under the stimulus pack-

age now would be indefinitely delayed," he said on Tuesday.

Even before the virus began disrupting trade and tourism flows and the current political crisis broke out, economic discontent has been slowly growing in Malaysia. Locals routinely complain about the rising cost of living, defying official data which shows inflation at its low-

Email ID: investor.relations@arvindbrands.co.in Website: www.arvindfashions.com

est level in a decade. And several recent studies show Malaysians are struggling to make ends meet. "There are a lot of issues that are bugging a lot of people, especially the cost of living, unemployment, inflation," said Ahmad Martadha Mohamed, a professor of government at Universiti Utara Malaysia in Kedah. "These are the issues that are

currently not being given enough attention by the government." Many people "see that whenever they go to the market the prices of goods are going up, purchasing power is becoming less, and younger people that graduated from university couldn't find proper jobs and are complaining about being unemployed," he said.

ACVIND FASHIONS

ARVIND FASHIONS LIMITED

CIN: L52399GJ2016PLC085595

Registered Office: Main Building, Arvind Limited Premises, Naroda Road, Ahmedabad-380025, Gujarat, India

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 ('the Act') read with Rule 22 of Companies (Management and Administration) Rules, 2014 (the 'Rules') and applicable provisions of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that the notice along with relevant Explanatory Statement, Postal Ballot Form and self - addressed Business Reply Envelope have been sent to the shareholders of the company at their registered address/e-mail on Monday 24th February 2020 for seeking their approval for sale/transfer of wholesale trading business in "Flying Machine" brand, as a going concern, on a slump sale basis to Arvind Youth Brands Private Limited, a wholly owned subsidiary of the Company by way of postal ballot including remote e-voting.

Members are hereby informed that the notice has been sent only to those shareholders whose names appear on the Register of Members/ List of beneficial Owners as received from the National Securities Depository Ltd (NSDL) and Central Depository Services (India) Limited (CDSL) as on Friday 21st February 2020 i.e. "the cut - off date". The voting rights shall be reckoned on the paid-up value of shares registered in the name of members as on Friday 21st February 2020. A person who is not a member as on cut - off date should treat this notice for information purpose only.

In accordance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015, the Company is providing facility to its members to exercise their votes electronically in respect of item(s) enlisted on the Postal Ballot notice through the remote evoting facility provided by NSDL

Details of Postal Ballot Schedule:

Sr. No.	Particulars	Schedule				
1	Date of Completion of dispatch of Postal Ballot Notice	25 th February 2020				
2	Postal Ballot/ remote e-voting commencement date	26 th February 2020 [09:00 a.m.]				
3	Postal Ballot/ remote e-voting end date	26 th March 2020 [05:00 p.m.]				
Any Postal Ballot received from the members or remote e-voting done by the members beyond the date of end of voting mentioned above shall be treated as invalid. The remote e-voting						

shall be disabled by NSDL at 05.00 p.m. on 26th March 2020

- All the members are therefore hereby informed that: 1. Members can opt for only one mode of voting, i.e. either by physical ballot or remote e-voting. In case Members cast their votes through both the modes, voting done by remote e-
- voting shall prevail and votes cast through physical Postal Ballot Forms will be treated as invalid. Mr. Hitesh Buch, (CP No.: 8195), Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries has been appointed as Scrutinizer for conducting remote e-voting/ Postal Ballot in accordance with the law in fair and transparent manner. For any queries/grievances, in relation to voting through post or electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. Link Intime India Pvt. Ltd.at
- In case a member is desirous of obtaining a printed Postal Ballot Form or duplicate, he or she may send an e-mail to ahmedabad@linkintime.co.in or investor.relations@arvindbrands.co.in The RTA or Company shall forward the same along with postage prepaid self-addressed Business Reply Envelope to the Member.

Members are requested, in case of voting through Postal Ballot, to carefully read the instructions printed in the Postal Ballot Form and return the Form duly completed and signed, in enclosed self-addressed Business Reply Envelope to the scrutinizer, Hitesh Buch & Associates, 310, Aditya Plaza, Nr. Karnavati Appartmnets, Jodhpur, Satellite, Ahmedabad – 380015, so that it reaches the scrutinizer not later than 26th March 2020. The postage will be borne by the Company. However envelopes containing Postal Ballots, if sent by courier or registered post at the expense of Members will also be accepted. If any Postal Ballot is received after 26th March 2020 it will be considered that no reply from the Member is received.

The result of the voting by Postal Ballot will be announced on or before 31st March 2020 at the registered office and the said results along with scrutinizer's report will also be displayed on the Website of the Company at www.arvindfashions.com besides being communicated to the Stock Exchanges i.e. NSE & BSE.

For Arvind Fashions Limited

Place: Bengaluru Date: 25th February 2020

Vijaykumar BS Company Secretary



Kotak Mahindra Capital Company Limited, Axis Capital Limited, DSP Merrill Lynch Limited, HSBC Securities and Capital Markets Limited at www.sebi.gov.in, at www.investmentbank.kotak.com, at www.axiscapital.co.in, at www.ml-india.com, at

This announcement does not constitute an invitation or offer of securities for sale in any jurisdiction, including the United States. The Equity Shares have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction. The Equity Shares have not been and will not be registered under the US Securities Act of 1933 ("U.S. Securities Act of 1933 (any applicable United States state securities laws. Accordingly, the Equity Shares are only being offered and sold (i) to "qualified institutional buyers" as defined in Rule 144A under the U.S. Securities Act; or (ii) outside the United States in offshore transactions in reliance on

www.business.hsbc.co.in/en-gb/in/generic/ipo-open-offer-and-buyback, at www.nomuraholdings.com/company/group/asia/india/index.html and at www.sbicaps.com, respectively. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details refer to the Red Herring Prospectus, including the section titled "Risk Factors"

financialexp.epapr.in

Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdiction where those offers and sales occur:

Ahmedabad

ડેવલપર્સે વિશ્વાસ ઊભો કરવા પર ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ: નદેલા

પીટીઆઈ

બેંગાલુરુ, તા. ૨૫ તેમાં નૈતિક્તા અને ભરોસો કે

ડેવલપરોએ વિવિધ ટીમોની પ્રાકતિક

સત્યા નદેલાએ મંગળવારના (એઆઈ)ને વિક્સાવવા માટે છીએ તેને લઈને વૈવિધ્ય સર્જાયેલા રોજ જણાવ્યું હતું કે ઉપયોગમાં લેવામાં આવતા ધરાવતી ટીમના નૈતિક મૂલ્યો આસપાસની લાભ દરેક માટે ઉપલબ્ધ બની પૂર્વગ્રહનો પગપેસારો ન થાય. રહી છે. તેમણે વધુમાં જણાવ્યું રહે તેની ખાતરી માટે જ્યારે નદેલાએ અત્રે ફ્યુચર ડિકોડેડ હતું કે મનમાં એક એવો સવાલ ભારતમાં આશરે ૪.૨ અમે ભારતમાં ત્રણ પ્રદેશો સોલ્યુશન્સ વિક્સાવતા હોય નામક કાર્યક્રમમાં જણાવ્યું હતું ધરબી રાખવાની જરૂર છે કે શું મિલિયન ડેવલપરો છે અને આ (પુના, ચેન્નાઈ અને મુંબઈ) આપણા જીવનમાં આ સોલ્યુશન્સનો ઉપયોગ દેશ આવનારા વર્ષોમાં આવા ધરાવીએ છીએ, અમે આ દરેક ઉભો કરવા પર ધ્યાન કેન્દ્રિત ટેકનોલોજી સર્વવ્યાપી અને છૂટક વિક્રેતા, હેલ્થકેર અને પ્રકારની પ્રતિભા માટેનું પ્રદેશોમાં વિશ્વભરમાં વિસ્તરણ પ્રસરણશીલ બની રહી છે. કૃષિ જેવા ઉદ્યોગોમાં સમૃદ્ધિ ન્યુમેરો ઉનો ગંતવ્યસ્થાન કરી રહ્યા હોવાથી તેનું તાત્પર્ય ભારતીય મૂળના આ તેની સાથે જવાબદારી પણ લાવવામાં કરાશે કે તે માત્ર બનવા તરફ અગ્રેસર જઈ રહ્યું અમે દરેક ડેટા રેસિડેન્સી અને એક્ઝિક્યુટિવે આવતી હોય છે. ડેવલપરોની સમાજના સાંકડા ભાગ માટે જ છે. ભારતમાં ત્રણ દિવસના ડેટા સોવેરિનીટી કાનૂનોને ભારપૂર્વક જણાવ્યું હતું કે એકલ પસંદગી ડિઝાઈનના ઉપયોગી બની રહેશે. તેમણે પ્રવાસે આવેલા નદેલાએ નોંધ અનુરૂપ કામ પણ કરી રહ્યા

સાથે કામગીરી નિભાવવી આસપાસની હોવી જોઈએ, ગ્રાહકોથી ભરેલા શ્રોતાવર્ગને ડેવલપરો કરીને આપણે જે સર્વસમાવેશક જણાવ્યું હતું કે મને એવું લાગે પ્રતિભાવદાયકો છે અને તેમણે માઈક્રોસોફ્ટના સીઈઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશ્વનું નિર્માણ કરવા જઈ રહ્યા છે કે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ટેકનોલોજીમાં ડેવલપરોએ ટેકનોલોજીના મોડલોમાં કોઈ અજ્ઞાત મહત્વની બાબત બનવા જઈ સ્થિતિ મહત્વપૂર્ણ બની રહેશે. જણાવ્યું હતું કે અમે પ૭ ડેટા

લક્ષણોની ડેવલપરો, પાર્ટનર્સ અને લેતાં જણાવ્યું હતું કે પ્લેટફોર્મ છીએ.

સરપ્લસની વિક્સાવવાની સર્વસામાન્ય રહેલી છે. તેમણે ઉમેરો કરતા માઈક્રોસોફ્ટના અનુસાર સેન્ટર પ્રદેશો ધરાવીએ છીએ.

Mutual Funds mein investments ki daily updates mil sakti hain.

Kya baat hai!



Mutual Fund investments can be tracked daily through the Net Asset Value (NAV) that is updated on the AMFI website every day. There are many such facts about Mutual Funds that will surprise you. Know more about Mutual Funds and plan your smart tomorrow.

#smarTomorrows www.canararobeco.com/smartomorrows An Investor education and awareness initiative

CANARA ROBECO

Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully. Investors should deal only with registered Mutual Funds, details of which can be verified on the SEBI website (https://www.sebi.gov.in) under 'Intermediaries/Market Infrastructure Institutions' Please visit http://bit.ly/cr-mandatory-disclosures to know about the process for completing one-time KYC (Know Your Customer ncluding process for change in address, phone number, bank details, etc. Investors may lodge complaints on the SCORES portal (https://www.scores.gov.in) against registered Mutual Funds if they are unsatisfied with their response

મજબૂત વૈશ્વિક સંકેતો, રૂપી પાછળ સોનાના ભાવ રૂપિયા ૯૫૪ તુટ્યા

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૨૫

વેચવાલીનું વલણ અને રૂ ા.૪૪,૫૦૩ના સ્તરે બંધ રહ્યા ા.૪૪,૦૩૦ પગલે આજે દિલ્હીમાં સોનાના સોમવારના રોજના રૂ સોનું આજે ૧,૬૫૦ ડોલરના ટ્રેડ થયું હતું. ભાવ દસગ્રામ દીઠ રૂા.૯૫૪ ા.૫૦,૦૭૦થી રૂા.૮૦ ઘટીને સ્તરની નીચે ગગડીને આજે ગગડીને રૂા.૪૩,૫૪૯ના રૂા.૪૯,૯૯૦ના સ્તરે બંધ આંતરરાષ્ટ્રીય હાજર સોનાના શેરબજારમાં વધારો અને કોરોનાવાઇરસે

જણાવ્યું હતું. અત્રે ઉદ્ઘેખનીય અને ૯૯૫ની શુદ્ધતા ધરાવતા સોનું ૨૪ કેરેટ માટે દિલ્હીમાં વધીને ૭૧.૮૦ના સ્તરે બંધ છે કે પીળી ધાતુના ભાવ સોનાના ભાવો દસ ગ્રામદીઠ રૂ વૈશ્વિક વ્યાપક વેચવાલીને થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા ટ્રેડિંગ સત્રમાં રૂ ા.૭૭૦ ઘટીને અનુક્રમે રૂ પગલે રૂા.૯૫૪ ઘટ્યું હતું. બજારમાં બંને સોના અને ચાંદી અને હાજર સોનું દિવસ દરમિયાન અનુક્રમે ૧,૬૪૮ ડોલર અને પિયામાં ડોલર સામે નરમાઇને હતા. ચાંદીના ભાવો રૂા.૪૩,૮૮૦ પર રહ્યા હતા. ડોલર સામે ૧૬ પૈસા વધીને ૧૮.૪૦ ડોલરના નીચા સ્તરે

રૂપિયો આજે સ્થાનિક એચડીએફસી સિક્યોરિટીઝે અનુસાર, દિલ્હીમાં ૯૯૯ વધારાને કાપ્યો હતો. હાજર ડોલરની પાછળ ૧૮ પૈસા મર્યાદિત કર્યું હતું

વિશ્વભરના પ્રસરી રહેલા સ્તરે બંધ રહ્યા હતા, તેમ રહ્યા હતા. ટિકર પ્લાન્ટ ભાવોમાસુધારાસાથે પાછલા વિદેશી બજારમાં નબળા ભાવમાં ઘટાડાના વલણને

પુમા ઇન્ડિયાનું વેચાણ ૨૩ ટકાની વૃદ્ધિ સાથે ૧,૪૧૩ કરોડના સ્તરે

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૨૫

ઉદ્દોખનીય છે કે, આર્થિક હતી, તેમ તેણે જણાવ્યું હતું. રાખીશું.

મંદીને સંખ્યાબંધ કંપનીઓની કંપનીના એમડી અભિષેક કામગીરી પર અસર થઇ છે, ગાંગુલીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ માટેની બ્રાન્ડ એમ પુમાએ એક યાદીમાં ભારત વિશ્વમાં કંપની માટે પુમાએ જણાવ્યું છે કે તેણે જણાવ્યું હતું.બ્રાન્ડની સફળતા ખુબ મહત્વનું બજાર છે. ૨૦૧૯ માટે તેની આવક ૨૩ ભારતમાં શ્રેણી-૨ અને શ્રેણી- સ્પોર્ટ્સમાં વિકાસ અને ખાસ ટકાના વધારા સાથે રૂપિયા ૩માં રહેલા ગ્રાહકોના કરીને યુવામાં ફેશનમાં ૧,૪૧૩ કરોડ નોંધાવી છે. આંકડાની વૃદ્ધિમાં પરિણમી સ્પોટસવેરમાં વધી રહેલી કંપનીએ આર્થિક મંદી ચાલી છે. આથી વધુમાં મહિલા અને ખ્યાતી સાથે અમે ભવિષ્યમાં રહી હોવા છતાં ડિસેમ્બર બાળકો જેવી શ્રેણી અને વૃદ્ધિમાટે મોટી ક્ષમતા જોઇ છે. ૨૦૧૯ના અંતે પૂરા થયેલા સ્પોર્ટસવેર બજારની કુલ વૃદ્ધિ અમે ભારતમાં અમારી નાણાંકીય વર્ષમાં બે આંકડાની ભારતમાં બ્રાન્ડ માટે વેચાણ ઉપસ્થિતિ મજબૂત કરવા અને વૃદ્ધિ નોંધાવી છે. અત્રે વધારવામાં ચાલક બ બની રોકાણો કરવાનું યથાવત

BAJAJ STEEL INDUSTRIES LIMITED Registered Office: Plot No. C-108

MIDC Industrial Area. Hingna, Nagpur - 440028 (MH) India. Tel.: +91-07104-238101, Fax: 07104-237067; mail: cs@bajajngp.com; Website: www.bajajngp.co (CIN: L27100MH1961PLC011936) PUBLIC NOTICE

Notice is hereby given that, pursuant to clause 6(a) of the SEBI (Delisting of Equity Shares, Regulations, 2009, the company is in the process of making application for Voluntary Delisting of its Equity Shares from the Calcutta Stock Exchange

Necessity and Object of delisting:
To save recurring expenditure on Listing Fee
payable to the aforesaid Stock Exchange where the
trading of Company's Equity Shares is either
negligible or nil. Since Company's Equity Shares
shall continue to be listed on "Bombay Stock
shall continue to be listed on "Bombay Stock
which has nationwide trading terminals, Delisting of
Equity Shares from Calcutta Stock Exchange
(hereinafter referred as "SES") will not Ardverselv hereinafter referred as "CSE") will not adversely

affect the investors. The Equity Shares of the Company will continue to be listed on the Bombay Stock Exchange,

February 24, 2020

For Bajaj Steel Industries Limited Divyanshu Vya Membership No.: A49516

SHRIRAM City MONEY WHEN YOU NEED IT MOST કાચનાન્સિયલ એસેટસ એન્ડ એન્કોર્સમેન્ટ . ઓફ સિક્ચોરિટી ઇન્ટેરેસ્ટ એક્ટ, રે૦૦૨ ની

શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સ લીમીટેડ– મુખ્ય ઓફીસ : વેવલ ૩, ઇસ્ટ વિંગ, વૉક્હાર્ટ ટાવર, બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ બાંદ્રા (પૂર્વ) મુંબઇ-૪૦૦૦૫૧ **૨જીસ્ટર્ડ ઓફીસ** : ૧૨૩, અંગપ્પા નાઇકન સ્ટ્રીટ, શ્રેજ્ઞાઇ-૬૦૦૦ **શાખા ઓફીસ** : બીજો માળ, શ્યામ સુંદર કોમ્પલેક્ષ, કાર્નાકિયા પ્લોટ, વિણક વાડી સામે, મુકામ અને પોસ્ટ., જેતપુર, રાજકોટ, જિલો ગુજરાત-૩૬૦૩૭૦ **ઇમેઇલ:** vishal.mehta@shriramcity.com વબસાઇટ : www.shriramcity.in CIN : L65191TN1986PLC012840

કલમ ૧૩(૨) હેઠળ નીચે મહી કરનાર મિક્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટક્શન ઓક ક્ષયનાન્મિયલ એમેટમ અને એનકોર્સમેન્ટ ઓક મિક્યોરીટી ઇન્ટરેસ્ ત્રેક્ટ, ૨૦૦૨ (જણાવેલ એક્ટ) હેઠળ શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સ લી. (એસસીયુએફએલ) ના અધિકૃત અધિકારી છે સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનકોર્સમેન્ટ)નિયમો. ૨૦૦૨ના નિયમ 3 સાથે વંચાતી જણાવેલ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ પ્રાપ્ત સત્તાન ઉપયોગ કરીને અધિકૃત અધિકારીએ નીચેના દેવાદાર(રો)/જામીનદાર(રો) (જણાવેલ દેવાદાર(રો)/ જામીનદાર(રો) ને તેમને જારી રાયેલ લાગતી વળગતી માંગણા નોટીસ(સો)માં જણાવેલ ૨કમો જે અહી નીચે પણ આપેલ છે પરત ચુકવવા માટે માંગણા નોટીસ જારી કરી હતી. ઉપરોક્તના અનુસંઘાનમાં, આથી એક વખત ફરીથી જણાવેલ દેવાદાર(રો)/ જામીનદાર(રો)ને આ નોટીસ પ્રસિદ્ધ થયાથી ૬૦ દિવસની અંદર એસસીયુએફએલને અહીં નીચે દર્શાવેલ રકમો ચુકવણીની તારીખ અને/અથવા છુટકારાની તારીખ સુધી નીચે જણાવેલ તારીખ(ખો)થી લાગુ અન્ય વ્યાજ સહીત, જણાવેલ દેવાદાર(ચે))જામીનદાર(ચે)દ્વારા કરાયેલ અન્ય દસ્તાવેજો/લખાણો જો કોઇ હોયતો ની સાથે વંચાતા લોન એગ્રીમેન્ટ હેઠળ ચુકવવાપાત્ર સહીત ચુકવી જવા નોટીસ આપવામાં આવે છે. લોનની બાકી ચુકવણી માટે સિક્યોરીટી તરીકે નીચેની એસેટો જણાવેલ દેવાદાર(રો)/જામીનદાર(રો) દ્વારા અનુક્રમે એસસીયુએફએલને મોર્ગેજ

૧ જય કૈલાશ ટેડર્સ (દેવાદાર)(પ્રોપ કલદીપ બી સંક્લેચા), શોપ નં.૨૧૩, પ્લોટનં. ૩૧૪, વોર્ડ ૧૨-બી, ગાંધીધામ, કચ્છ-૩૭૦૨૦૧ .**.કુલદિપ ભગવાનચંદ સંકલેચા** (સહ-વાદાર/જામીનદાર), પ્લોટ નં.૮૬, વોડી ૮ એ, ગાંધીધામ, કચ્છ-૩૭૦૨૦૧. 3**.અનિતા કુલદિપ સંકલેચા**(સહ-ધાદાર/જામીનદાર) પ્લોટ નં.૮૬, વોડ્ડ ૮એ, ગાંધીધામ, કચ્છ-૩૭૦૨૦૧

કરવામાં આવી છે.

(સ્થાવર મિલકતો) નું વર્ણન માલિકઃ શ્રી ભગવાનચંદ સંકલેચા, તેમમે તે એસઆરઓ રાજકોટમાં ફાઇલ કરેલ સબ પ્લોટ નં. ૧૫/એ–સી/૩, રાજકોટ રેવેન્ય સર્વે નં. ૪૦૨, સીટી સર્વે વોર્ડ નં ા/૨, સીટી સર્વે નં. ૨૭૧૫/૩, પેટા જિલ્લો અને જિલ્લો રાજકોટ, ગુજરા રાજ્યા ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીય શેડના તમામ પીસ અને પાર્સલ. જમીનનું ક્ષેત્રફળ સરકા ગામ આવલ છે હસૂત્ર સાંક્રમાં પામ માસ ગામ માસલા કરામ ધુક્રમ ૩૯૦-૪૧ ચો.મી. એટલે કે ૪૬૬-૬૬ ચો. અને ચતુઃસીમાઃ ઉત્તરઃ સબ પ્લોટ નં. ૧પ/એ-સી/૨, તેની એમએસએમટીથી ૩૬.૫૯ મી. દક્ષિણઃ સબ પ્લોટ નં. ૧૫/એ-સી/૪, તેની એમએસએમટીથી ૩૬-૫૯ મી પુર્વઃ૧૨-૧૯ મી. રોડ, તેની એમએસએમટીથી ૧૦-૬૭ મી. પશ્ચિમઃ અન્ય મિલકત, તેની એમએસએમટીથી ૧૦-૬૭ મી.

સિક્ચોર્ડ મિલકતો

માંગણા નોટીસની તારીખ અને રકમ **૪. રત્નમ સ્ક્રેપ** (સહ–દેવાદાર/જામીનદાર) રૂા. ૧,૫૫,૪૪,૪૧૫/- (રૂપિયા એક કરોડ પંચાવન લાખ ચુંબાલીસ હજાર ચારસો પંદર પુરા) ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ મુજબ (પ્રોપ ભગવાનચંદ જી સંકલેચા) ૪, એનપીએ તારીખઃ ૩ જાન્યુંઆરી ,૨૦૨૦ માંગણા નોટીસની તારીખઃ ૧૮-૦૨-૨૦૨૦ કમાકાંત પંડિત ઉદ્યોગનગર, માવડી પ્લો*ર* રાજકોટ-૩૬૦૦૦૫ લોન એગ્રીમેન્ટ નં. RSRAJTF170228000

જો સદરહુ દેવાદાર(રો)/જામીનદાર(રો)એસસીયુએફએલને ઉપર જણાવ્યા મુજબ નાણાં યુકવવામાં નિષ્ફળ જાય, તો એસસીયુએફએલ ઉપરની સિક્યોર્ડ અસ્ક્યામતો સામે સદરહુ દેવાદારો)/જામીનદારો ના ખર્ચે અને જોખમે સદરહુ કાયદાની કલમ ૧૩(૪) અને લાઃ પડતા નિયમો હેઠળ પગલાં લેશે. સદરહુ દેવાદારો/જામીનદારો ને કાયદા હેઠળ મનાઇ ફરમાવવામાં આવે છે કે સદરહુ મિલકતો રેચાણ, લિઝ કે અન્ય ક્રોઇ રીતે એસસીયુએફએલની લેખિત પૂર્વમંજુરી સિવાય તબદિલ કરવી નહીં. ક્રોઇ પણ વ્યક્તિ સદરેહુ કાયદા**ન** કે તે હેઠળ રચેલ નિયમોનો ભંગ કરે કે ઉદ્યાંઘન કરે તો તે કાયદા હેઠળ જેલની સજા અને/અથવા દંડને પાત્ર બનશે સહી/– અદ્યિકૃત અદ્યિકા<u>ર</u>ી શ્રીરામ સિટી યુનિયન ફાયનાન્સ લીમીટેડ

ALCHEMIST

CIN- L72200DL1988PLC192643

Regd. Office: Building No. 23, Nehru Place, New Delhi- 110019 Tel.: +91-11-40600800, Fax: +91-11-40600888 Email: investors@alchemist.co.in Website: www.alchemist.co.in

ALCHEMIST LIMITED

Postal Ballot Notice Notice is hereby given that, pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 and other applicable provisions, if any of the Act and Regulation 44 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 and other applicable provisions, the Company is seeking approval of the Members by way of Postal Ballot, which includes voting by electronic means ("Remote E-Voting") for Slump Sale of Pharma Division of the Company through Specia

Resolution as set out in the Postal Ballot notice dated Wednesday, February 12, 2020 spatch of Postal ballot Notice and Postal Ballot form along with self-addressed reply envelope to all the members whose names appeared in the Register of Members/Record of Depositories as n Friday, February 21, 2020, has been completed on Tuesday, February 25, 2020.

he Company has engaged M/s Link Intime India Private Limited ("LIIPL") for providing Remote E-Voting services through its E-Voting platform. The instructions for E-Voting are given in Postal allot Notice. The Postal Ballot Notice together with Postal Ballot from is also available on the Website of the Company at www.alchemist.co.in.

person whose name is recorded in the Register of Members or in the Register of Beneficia Owners maintained by the Depositories (in case of shares held in Demat form) as on Friday February 21, 2020, shall be entitled to vote on the proposed resolution.

CS Kanwaljit Singh, Practicing Company Secretary (Membership No. F5901), has been ppointed as a Scrutinizer for conducting the Postal Ballot in fair and transparent manne

The voting, including Remote E-Voting commences at 9.00 am on Tuesday, February 25 2020 and ends on Wednesday, March 25, 2020 at 5.00 pm. The E-Voting module will be disabled by LIIPL for voting thereafter. Any Postal Ballot received from a Member beyond 5.00 pm on Wednesday, March 25, 2020

will be invalid and shall be treated as if reply from the Member has not been received. A Member may request M/s Link Intime India Private Limited, Registrar and Transfer Agent for a duplicate copy of Postal Ballot Form, if required and also download from website of the Company at www alchemist co in

Any query or grievance connected with voting by postal ballot, other than E-Voting, may addressed to the Company Secretary at Alchemist Limited, Registered Office-Building No. 23, Nehru Place, New Delhi-110019, Contact No.- +91-11-40600800 Email: investors@alchemist.co.in. The results of voting shall be announced on or before Friday, March 27, 2020. The results

declared along with the Scrutinizer's Report shall be placed on the Company's Website www.alchemist.co.in for information of the Members. The results shall also be communicated to the Stock Exchange where the shares of the Company are listed.

A person, who is not a member of the Company on the "Cut-off date, shall treat this notice fo

the information purposes only.

For ALCHEMIST LIMITED

Date: February 25, 2020

ACVIND FASHIONS

CIN: L52399GJ2016PLC085595

રજીસ્ટર્ડ ઓફીસ: મેઇન બિલ્ડીંગ, અરવિંદ લીમીટેડ પ્રીમાઇસીસ, નરોડા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૫, ગુજરાત, ભારત. ફોન : + ૯૧૭૯ ૬૮૨૬૮૦૦૦, ઇમેઇલ : investor.relations@arvindbrands.co.in વેબસાઇટ: <u>www.arvindfashions.com</u> <u>પોસ્ટલ બેલટ નોટીસ</u>

સેક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટસ) નિયમોનો, ૨૦૧૫ ની લાગુ જોગવાઇઓ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમે માર્ગે 'ફ્લાયીંગ મશીન'' બ્રાન્ડ, ચાલુ પેઢી તરીકે હોલસેલ ટ્રેડિંગ બિઝનેસની અરવિંદ યુથ બ્રાન્ડ્ય પ્રાણ્વેટ લીમીટેડ, સંપુર્ણ રીતે કંપનીની માલિકીની પેટા કંપનીને સ્લમ્પ સેલના ઘોરણે વેચાણતબદીલી માટે તેમની મંજુરી લેવા માટે મોકલવામાં આવ્યા છે. આથી સભ્યોને જાણ કરવામાં આવે છે કે નોટીસ જેમના નામ શુક્રવાર, ૨૧ કેબ્રુઆરી ૨૦૨૦ એટલે કે કટ-ઓફ પ્રેટના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સનિશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસ પ્રેએલ) અને સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ (સી.પ્રેએસએલ) પાસેથી મેળવેલ બેનિફિસિયલ ઓનર્સની યાદીમાં હાજર છે તેમને જ મોકલવામાં ત્રાવ્યા છે. જે વ્યક્તિ કટ-ઓફ ડેટ ના રોજ સભ્ય ન હતી તેમને આ નોટીસને ફક્ત માહિતીના હેતુસર લેવાની રહેશે.

ધંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ના નિયમ ૨૦ અને સેબી (એલઓડીઆર) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૪૪ સાથે વંચાતી કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૧૦૮ મુજબ કંપન ોનએસડીએલ દ્વારા પુરી પડાયેલ રીમોટ છ-વોટીંગ મારફત પોસ્ટલ બેલટ નોટીસમાં જણાવેલ વિગત(તો) ના સંદર્ભમાં છલેક્ટ્રોનિક રીતે તેમના વોટ આપવાની તેના સભ્યોને સુવિધા પુરી પાડી રહી છે

- 1						
- 1	ક્રમ	વિગતો	સુચી			
- 1	٩.	પોસ્ટલ બેલટ નોટીસની રવાનગી પુરી કર્યાની તારીખ	ર૫મી ફેબ્રુઆરી ૨૦૨૦			
- 1	₹.	પોસ્ટલ બેલટ/રીમોટ ઇ–વોર્ટિંગની શરૂઆતની તારીખ	રદ્દમી ફેબ્રુઆરી ૨૦૨૦ (૦૯.૦૦ a.m.)			
- 1	3.	પોસ્ટલ બેલટ/રીમોટ ઇ–વોટીંગની સમાપ્તિની તારીખ	રદ્દમી માર્ચ ૨૦૨૦ (૦૫.૦૦ p.m.)			
- 1	િઉપર જણાવેલ વોર્ટીંગ સમાપ્તિની તારીખ પછી સભ્યો પાસેથી મળેલ કોઇપણ પોસ્ટલ બેલટ અથવા સભ્યો દ્વારા કરાયેલ ઇ–વોર્ટિંગ અમાન્ય ગણાવામાં આવશે ઇ–વોર્ટીંગ રદ્દમી માર્ચ ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ થી બંધ કરવામાં આવશે.					
- 1						

. સભ્યો મતદાનની ફક્ત એક જ રીતે પસંદ કરી શકે છે, એટલે કે ભૌતિક પોસ્ટલ બેલટ અથવા રીમોટ ઇ-વોટીંગ. સભ્યોએ તેના મતો બં**ત્રે** રીત દ્વારા આપ્યા હોય તો તેવા કિસ્સામાં રીમોટ ઇ-વોટિંગથી કરાયેલ વોટો ધ્યાનમાં લેવાશે અને ભૌતિક પોસ્ટલ બેલટ ફોર્મથી કરાયેલ વોટો અમાન્ય ગણાશે.

કલપલ યાદા આપ્તા લયાત જાપ ખાતાક પાસ્ત જાવદ કાવવા કરાવલ યાદા જાપાય પણાત. શ્રી તિત્રો છુલ (યોપીમાં ને ૧૧૫) પ્રોપસાઇટર, હિત્રો છુલ એન્ડ એસોસિયેટ્સ, વ્યવસાયિક કંપની સચીવની કાનુન મુજબ યોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં રીમોટ ઇ-વોટીંગ/પોસ્ટલ બેલટનું સંચાલ કરવા માટે સ્કુટીનાઇઝર તરીકે નિપાધુંક કરવામા આવી છે. પોસ્ટ અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમોથી વોટીંગને સબંધિત કોઇપણ પુછપરછ/ફરિયાદ માટે સભ્યો રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) એટલે કે લિંક ઇનટાઇમ પ્રાઇવેટ લીમીટેડનં

પ્રિન્ટેડ પોસ્ટલ બેલટ ફોર્મ અથવા ડુપ્લીકેટ ફોર્મ મેળવવા ઇચ્છતા સભ્યો તે અથવા તેણી <u>ahmedabad@linkintime.co.in</u> અથવા <u>investor.relations@arvindbrands.co.in</u> પર ઇમેઇ

મોકલી શકે છે. તારવા શકછ. પોસ્ટલ લેલ્ટ યાક્ત મહાનના કિસ્સામાં સભ્યોને પોસ્ટલ બેલટ ફોર્મમાં છપાયેલ સુચનાઓ ધ્યાનથી ચાંચવા અને સ્કૂટીનાઇઝર, હિતેશ બુચ એન્ડ એસોસિયેટ્સ, ૩૧૦, આદિત્ય પ્લાઝા, કર્ણાવતી એપાર્ટમને પાસે, જોયપુર, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧પને ૨૬મી માર્ચ ૨૦૨૦ પહેલા સ્કૂટીનાઇઝરને મળે તે રીતે જો ગ્રયેલ સ્વ સસ્નામાં વાળા બિઝનેસ રીપલાય એન્વેલોમાં સંપૂર્ણ રીતે ભરીને અને સહી કરીને

ારત કરવા વિનંતી છે. આમ છતાં, સભ્યોએ પોતાના ખર્ચે કરીયર અથવા રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલેલ પોસ્ટલ બેલટના એન્વેલોય પણ સ્વીકારવામાં આવશે. જો કોઇપણ પોસ્ટલ બેલટ ર ૬ માર્ચ ૨૦૨ ાછી મળશે તો તે સભ્યો દ્વારા કોઇ જવાબ મળ્યો નથી તેમ ગણવામાં આવે છે. પોસ્ટલ બેલટ દ્વારા વોટીંગના પરિણામોની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે ૩૧મી માર્ચ ૨૦૨૦ ના રોજ અથવા તે પહેલા જાહેરાત કરવામા આવશે અને જણાવેલ પરિણામો તેમજ સ્ફૂટીનાઇઝરના અહેવાલ કંપનીનં

નસાઇટ <u>www.arvindfashions.com</u> પર પણ મુકવામાં આવશે અને સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઇ અને બીએસઈને પણ જાણ કરવામાં આવશે. અરવિંદ કેશન્સ લીમીટે: વિજય કુમાર બીએર તારીખ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ કંપની સચિવ

જીઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિ.

અંક્રેક્તાના કોર્પોરેટ ઓફિસ/હેડ ઓફિસ: જીઆઇસીએચએકએલ, નેશનલ ઇન્સ્યોરન્સ બિલ્ડિંગ, છઢો માળ, જે.ટી. રોડ, એસ્ટોરીઆ હોટલની બાજુમાં, ચર્ચગેટ, મુંબઇ – ૪૦૦૦૨૦. ટેલીફોન : (૦૨૨) ૨૨૮૫૧૭૬૫-૬૬-૬૭ ઇ-મેઇલ : corporate@gichf.com Website: www.gichfindia.com વડોદરા બ્રાન્ચ : ૨૧૧, બીજો માળ, પનોરમા કોમ્પ્લેક્ષ, આર.સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા, પીન-૩૯૦૦૦૭ સંપર્ક : ટેલીફોન :૦૨૬૫-૨૩૨૩૫૯૦, ૦૨૬૫-૨૩૨૩૫૯૧ ઇ-મેઇલ : vadodara@gichfindia.com સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ, ૨૦૦૨ના રુલ ૮ના પેટા-રુલ (૧) હેઠળ પઝેશન નોટિસ

આથી નીચે સહી કરેલ જીઆઇસીએચએકએલના અધિકૃત અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ ડીમાન્ડ નોટિલ જે નીચે જણાવેલી તારીખે સરકેસી એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩(૨) હેઠળ તમને દેવાદારને જણાવવામાં આવે છે કે નીચે આપેલા નામધારીઓએ આ નોટિસ મળ્યાની તારીખથા ૬૦ દિવસની અંદરમાં રકમની ચૂકવણી કરવાનું જણાવવામાં આવે છે. આપ સૌ લેણી નીકળતી રકમ નિશ્ચિત સમયમાં ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી જીઆઇસીએચએફએલ અને તેને અધિકાર છે સરફેસી એક્ટ, ૨૦૦૨ના સેક્શન ૧૩ના પેટા સેક્શન (૪)ની જોગવાઇ સાથે નીચેના રુલને જણાવતાં નીચે જણાવેલી સિક્યોર્ડ મિલકતનો પ્રતીકાત્મક કબજો મેળવેલ છે.

용ਮ	દેવાદાર અને સહદેવાદારના નામ/ જામીનદારનું નામ/લોન ફાઇલ નં/બ્રાંચનું નામ	ગીરવે મૂકેલી મિલકતનું સરનામું	ડીમાન્ડ નોટિસ મોકલેલી તારીખ	તા.૩૧-૦૧-૨૦૨૦ના રોજ રીકવરી અને કાયદેસર સિવાયના ચાર્જીસના લેણાં (રૂ.માં)	પ્રતીકાત્મક કબજાની તારીખ
વ	શ્રી નિલેશ પોપટલાલ જૈન અને શ્રીમતી પ્રમીલા પોપટલાલ જૈન. જામીનદાર : અમીત પોપટલાલ જૈન ફાઇલ નં. GJ0430110001075 બ્રાંચનું નામઃ વડોદરા	એચઓ નં. સી-૭૧, અંબિકા પાર્ક સોસાયટી, આઈપીસીએલ ટાઉનશીપ રોડ, ગાયત્રીકૃપા પેટ્રોલ પંપ પાસે, ગોરવા, વડોદરા, પીન- ૩૯૦૦૧ દ. ચતુર્સીમા : ઉત્તર : પ્લોટ નં. બી/૬૭ દક્ષિણ : સોસાયટી રોડ પૂર્વ: પ્લોટ નં. સી/૭૦ પશ્ચિમ: પ્લોટ નં. સી/૭૦	०५/०५/२०१५	૧ <i>૬</i> ,८૭,૪૧ <i>૯/-</i>	२ ६ - ० २ - २ ० २ ०
ર	શ્રી અલ્પેશ નાગજીભાઈ દેસાઈ કાઇલ નં. GJ0430610001249 બ્રાંચનું નામ : વડોદરા	એ-૧૦૧, અક્ષર વિન્ટેજ, તરસાલી બાયપાસ ઓવર બ્રીજ પાસે, તરસાલી, વડોદરા, પીન- ૩૯૦૦૦૯. અતુર્સીમા : ઉત્તર : બ્લોક નો. એ/૧૦૦ દક્ષિણ : બ્લોક નો. એ/૧૦૨ પૂર્વઃ બ્લોક નો. એ/૧૦૮ પશ્ચિમ:સોસાયટી ઈન્ટરનલ રોડ	03/10/2012	૧૧, €€,८२२/-	२६-०२-२०२०
3	શ્રી દેવેન્દ્ર ઈશ્વરભાઈ પટેલ અને શ્રીમતી જ્યોત્સનાબેન ઈશ્વરભાઈ પટેલ ફાઇલ નં. GJ0430610001226 બ્રાંચનું નામ ઃ વડોદરા	બી-૧૯, જશલોક કો- ઓપ.હાઉસીંગ સોસાયટી લી., દીપ ચેમ્બર પાસે, માંજલપુર, વડોદરા, પીન-૩૯૦૦૧૧. ચતુર્સીમા: ઉત્તર: પ્લોટ નં. બી/૧૮ દક્ષિણ: પ્લોટ નં. બી/૨૦ પૂર્વઃ સોસાયટી રોડ પશ્ચિમ: ટી.પી.રોડ	12/11/2016	૧૨,૧૩, <i>६४</i> ૧/-	₹-0₹-₹0₹0

બાથી દેવાદારને આ નોટિસ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ આ મિલકત જીઆઇસીએચએફએલને ખાલી કરીને શાંતિપૂર્વક નોટિસની તારીખથી સાત દિવસની અંદર સોંપી દે, અન્યથા નીચે સહી કર્યા અનુસાર મિલકતનો ફિઝિકલ કબજો ઉપરોક્ત મિલકત માટે જબરદસ્તીથી મેળવવાની પ્રક્રિયા કરવામાં આવશે અન્યથા/અને ઉપરોક્ત જણાવેલી મિલકત સરફેસી એક્ટ, ૨૦૦૨ અને તેના રુલ્સ હેઠળ એડોપ્ટ કરવાની પદ્ધતિથી ત્રીસ દિવસની અંદર વેચાણ

દેવાદાર અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત જણાવેલી મિલકત અંગે કોઇ પ્રકારનો વ્યવહાર કે ડીલ કરવી નહીં અને જો તે કરવામાં

આવશે તો તે જીઆઇસીએચએફએલના ચાર્જમાં ઉપરોક્ત જણાવેલ રકમ જે ચૂકવણીને પાત્ર બને છે તેના હકમાં કુલ ચૂકવણી રૂપે ગણવામાં આવશે. જાઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિ. વતી વારીખ : ૨૬-૦૨-૨૦૨૦ સ્થળ : વડોદરા, ગુજરાત સહી/- અધિકૃત અધિકારી

ALLAHABAD BANK इलाहाबाद बेंक

ઉદ્યારકર્તાઓ/જામીનદાર/મોર્ગેજરનું નામ

/ સરનામું અને શાખાનું નામ

ઝોનલ ઓફિસ : ૧લો માળ, ઓફિસ નં. ૧૦૪ અને ૧૦૫, ઝોડીયક પ્લાઝા, સેન્ટ ઝેવીયર્સ કોલેજ કોર્નર, એચ.એલ. કોમર્સ કોલેજ રોડ, નવરંગપુરા,

માંગણા

लोन એકाઉन्ट नं. 50182968378

રૂા. ૧૫,૬૪,૧૧૪/-

Bikram Bhattacharya

(Whole Time Director) DIN: 03595530

સિક્યોરિટાર્ઘાગ્રેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓફ કાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ડોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૨)ના પ્રકરણ - ૩ પ્રમાણે નાણાંકીય અસ્ક્યામતોના જામીનીકરણ અને પુનઃરચના અને જામીનગીરીના હિતના અમલીકરણ અધિનિયમ ૨૦૦૨ હેઠળ બેંકના અધિકૃત અધિકારી દ્વારા નીચે જણાવેલા દેવાદારો / ગિરવેદારો અને જામીનદારોને અલગ અગલ રીતે સ્પીડ પોસ્ટ, રજીસ્ટર એડીથી તેમના દ્વારા જણાવવામાં આવેલા એડ્રેસ પર મોકલવામાં આવેલ હતી, જે ત્યાં કોઈ હાજર ન હોવાથી પરત થયેલ છે. અધિકૃત અધિકારી એમ માને છે કે દેવાદારો /ગિરેવદારો અને જામીનદારો તેમન

	મોર્ગેજર), જી-૧, અનુરાધા એપાર્ટમેન્ટ, મધુબેન સોસાયટીની પાસે, જીઆઈડીસી, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨, (૨). શ્રી રામજીત વિશ્વકર્મા (ભામીનદાર), ૧૦૧, અનુરાધા એપાર્ટમેન્ટ, મધુબન સોસાયટીની પાસે, જીઆઈડીસી, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨, (૩). શ્રી અજીત કાશીભાઇ પટેલ (ભામીનદાર), સી-૭૩, સ્વસ્તિક પાર્ક, કોસમડી, વાલીયા રોડ, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨. (અંકલેશ્વર શાખા) એનપી એ ની તારીખ : ૧૪.૦૧.૨૦૨૦, ડીમાન્ડ નોઢીસ : ૨૨.૦૧.૨૦૨૦.	નં. જી-૧, સાથેની જર્મ જુનો સર્વે નં ૬૧/૬૨, લ મિલકતની જગ્યા, પશ્ચિ
₹.	(૧). પ્રમોદ એમ. પાઠક કું. (પ્રોપાઇટરશીપ કર્મ, ઉદારકતા), બી-૧૫, સાઈલોક ટેનામેન્ટ, સમતા હાઉસીંગ સોસાયટી, સારંગપુર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨ અહી પણ : એસ/૩૩, ઉમા કોમ્પલેક્ષ, જુનો એન. એચ. ૮, જીઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર, અલ્હાબાદ બેંકની પાસે, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨., (૨). શ્રીમતી અંજલીઠેન પ્રમોદ પાઠક (પ્રોપ્રાઇટર અને મોર્ગેજર), બી-૧૫, સાંઈલોક ટેનામેન્ટ, સમતા હાઉસીંગ સોસાયટી, સારંગપુર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨., (૩). શ્રી પ્રમોદ એમ પાઠક (જામીનદાર), બી-૧૫, સાંઈલોક ટેનામેન્ટ, સમતા હાઉસીંગ સોસાયટી, સારંગપુર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત - ૩૯૩૦૦૨. (અંકલેશ્વર શાખા) એનપીએ ની તારીખ: ૨૮.૦૧.૨૦૨૦, ડીમાન્ડ નોટીસ: ૦૩.૦૨.૨૦૨૦.	4. બધી જ તમે બી - ૧ ચોકડી, અં એચ. ૮, જી કોઈપણ અ ૨. શ્રીમતી બી/૧૫, જે ટેનામેન્ટ" તાલુકો - અ ચતુઃસીમા જોડેનો પ્લોટ

(૧). સંતોષ ટ્રેડીંગ કું. (પ્રોપ્રાઇટરશીપ ફર્મ, ઉદ્યારકર્તા), શેડ નં. ૭૧, પરીશ્રમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જનતાનગરની પાસે, રામોલ રોડ, રામોલ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૯., **(૨). શ્રી સંતોષસિંહ નરેન્દ્રસિંહ ચોહાણ (પ્રોપ્રાઇટર** . અ**ને જામીનદાર),** બી-૨૩૦, હરીદર્શન પાર્ક સોસાયટી. શંકર એસ્ટેટની પાછળ સુરેલીયા રોડ, અમરાઈવાડી, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૨૬., (3). શ્રી જેશકુમાર હંસરાજસિંઘ રાજપુત (જામીનદાર અને મોર્ગેજર), એફ-૧૧૮, હરીધામ સોસાયટી, પાર્શ્વનાથ ટાઉનશીપ, નરોડા રોડ, અમદાવાદ, ગુજરાત ૩૮૨૩૪૦. **(જુનો** શા**રદા મંદિર શાખા)** મેનપીએ ની તારીખ : ૨૯.૦૧.૨૦૨૦, ડીમાન્ડ નોટીસ : ૦૩.૦૨.૨૦૨૦.

અમદાવાદ - ૩૮૦૦૦૯. ● ફોન : ૨૬૩૦૪૩૧૫-૧૭ ● ફેક્સ : ૨૬૩૦૪૩૧૪

દ્વારા મોકલવામાં આવતી નોટીસની અવગણના કરે છે. તો તેના આધારે એને ઉપરોક્ત નિયમની કલમ ૩(૧)ના આધારે તેમની વિરૂદ્ધ નીચે પ્રમાણે નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવે છે. મુક્સ્ટ મિલકતોનું વર્ણન (ગીરો / હાર્દપોથીકેશન મિલકતો) કુલ લ્હેંશી રકમ (વત્તા બાકી લ્હેશીના પુરી રકમ અને આખર શ્વેટલમેન્ટ સુધી થતું વ્યાજ) ૧. (૧). શ્રી રામભરણસિંહ મુનસીસિંહ રાજપુત (ઉદારકર્તા, જામીનદાર અને 🛭 શ્રી રામભરણસિંહ મુનસીસિંઘ રાજપુતના નામની ફ્રી હોલ્ડ સ્થાવર રહેઠાણ લાયક કલેટ लोन એકाઉन्ट नं. ગ્રાઉન્ડ ફલોર, જેનું આશરે ક્ષેત્રફળ ૬૦.૩૮ સ્કે. મી., અવિભાજીત હકક 21209086769 મીનનું ક્ષેત્રફળ ૧૦.૦૦ સ્કે. મી., ''અનુરાધા એપાર્ટમેન્ટ'' થી જાણીતી સ્કીમ કુલ લ્હેંણી રકમ તા. નં. ૨૧૪/૨/એ અને નવો સર્વે નં. ૨૫૩ અને ૨૫૧/એ પૈકી. જે સ્થિત પ્લોટ નં ભાડકોદ્રા, અંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, રાજય - ગુજરાત ખાતે આવેલ સમગ્ર રવ.૦૧.૨૦૨૦ ના રો૧ **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે**ઃ આંતરીક રોડ<mark>, દક્ષિણે</mark>ઃ ફલેંટ નં. જી/૨, **પૂર્વે**ઃ ગાર્ડનની **३**1. २,४८,⊊€€/-**દામે**ં પાર્કીગ.

જંગમ મિલ્કત્નો સ્ટોર્સ, સ્ટોક અને બુક ડેબ્ટ્સ અને અન્ય વેપારના સાધૂનો જે ૧૫, સાંઈલોક ટેનામેન્ટ, સમતા હાઉસીંગ સોસાયટી, સારંગપુર, રાજપીપળ કલેશ્વર, જીલ્લો - ભરૂચ, ગુજરાત અને એસ/૩૩, ઉમા કોમ્પલેક્ષ, જુનો એન કુલ લ્હેંણી રકમ તા. છઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર, અલ્હાબાદ બેંકની પાસે, જીલ્લો - ભરૂચ અને ૦૨.૦૨.૨૦૨૦ ના રોજ ાન્ય જગ્યાએ. અંજલીબેન પ્રમોદ પાઠકના નામની ફ્રી હોલ્ડ સ્થાવર રહેઠાણ લાયક પ્લોટ નં

જે એરીયાના બાંધકામનું આશરે ક્ષેત્રફળ ૭૧.૦૦ સ્કે. મી., ''સાંઈલોક થી જાણીતી સ્કીમ, રેવન્યુ સર્વે નં. ૨૧૬ પૈકી, જે સ્થિત ગામ - સારંગપુર ખંકલેશ્વર, જીલ્લો - ભરૂચ, રાજય - ગુજરાત ખાતે આવેલ સમગ્ર મિલકર્તન ઃ- **ઉત્તરે** : જોડેની ખુલ્લી જમીન, **દક્ષિણે** : જોડેનો પ્લોટ નં. બી/૧૬, **પૂર્વે** ટ નં. બી/૧૪, **પશ્ચિમે**ં જોડેનો આંતરીક રોડ. ા. બધી જ જંગમ મિલકત નો પ્લાન્ટ. એન્જિન્સ. મશીનરીઓ, સાધનો, સ્ટોર્સ, સ્ટોક, અન્ **લોન એકાઉન્ટ નં.** ટુર્લ્સ અને અન્ય વેપારના સાધનો જે તમે શેડ નં. ૭૧, પરીશ્રમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ

50304291129 . ૪નતાનગર પાસે, રામોલ રોડ, રામોલ, અમદાવાદ, ગુજરાત અને કોઈપણ અન્ય જગ્યાએ કુલ લ્હેંણી રકમ તા. ૨. શ્રી રાજેશકુમાર હંસરાજસિંઘ રાજપુતના નામની ફ્રી હોલ્ડ્ર સ્થાવર રહેઠાણ લાયક ટેનામેન્ટ નં. બી/૨૬, જેનું આશરે ક્ષેત્રફળ ૪૦૨૪.૦૩ સ્કે. મી., શ્રી સતકેવલકૃપા કો. ઓ. હાઉસીંગ લિમીટેડ ની "કર્ણાવતીનગર.૯૬ સ્કે. મી. અને બાંધકામનું ક્ષેત્રફળ રૂા. ૧૫,૪७,७૩૪/-સોસાયટી'' થી જાણીતી સ્કીમ, બીન ખેતીલાયક જમીનનો સર્વે નં. ૭૯૨ થી ૭૯૬, ૮૦૨, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ટેનામેન્ટ નં. ૦૪૪૪-૦૭-૧૧૪૧-૦૦૦૧-ટી, મોજે - નવા નરોડા સીમ, તાલુકો - અસારવા, રજીસ્ટ્રેશન જીલ્લો અને સબ જીલ્લો - અમદાવાદ - ફ (નરોડા) રાજય - ગુજરાત ખાતે આવેલ સમગ્ર મિલકતની **ચતુઃ ત્રીમા : ઉત્તરે** : ટેનામેન્ટ નં. બી/૨૭, **દક્ષિણે** : ટેનામેન્ટ નં. બી/૨૫, **પૂર્વે** : ટેનામેન્ટ નં. બી/૪૧, **પશ્ચિમે** : ટેનામેન્ટ નં. બી/૧૯.

કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે નીચે મુજબના પક્ષોનું મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.'' આ બાબતની ખાસ નોંધ લેવી કે તમે જણાવેલી મિલકતો ઉપરોક્ત એકટની કલમ ૧૩(૧૩) પ્રમાણે તમે કોઈને પણ લીઝ, વેચાણ કે અન્ય રીતે બેંકની લેખીત પરવાનગી વગર આપી શકશો નહીં. જો તે વિરૂદ્ધમાં કોઈપણ લેવડદેવડ કરવાર આવશે તો તે ગુનો લેખાશે. આથી આપ સર્વેને આ નોટીસથી જાણ કરવામાં આવે છે કે સરફેસી કાયડાની કલમ ૧૩(૨) અંતર્ગત તમને જાણ કરવામાં આવે છે કે તમારે આ નોટિસ મળ્યાના ૧૦ દિવસ સુધીમાં ઠરાવેલ સંપૂર્ણ ભરપાઈ કરવાના રહેશે એમ કરવામાં કસુર થશેતો સરફેસી બેંક કાયદાકીય પગલાં લેશે અને કાયદાની કલમ ૧૩(૪) અંતર્ગત આપેલ સત્તાનો ઉપયોગ કરશે. બેંકને મળેલ સત્તાઓ પ્રમાણે બેંક કેટલાક નિર્ણયો લઈ શકે છે. ઉપરોક્ત રકમની ભરપાઈ ન કરાતા બેંકે ઉપરોક્ત મિલકતોનો કબજો લઈ શકે છે. દેવાદરો અને જામીનદારોને અવગત કરવામાં આવે છે કે તેમણે ડિમાન્ડ નોટીસ કલમ ૧૩(૨) પ્રમાણે ઓરિજિનલ કોપી નીચે સહી કરનાર પોસેથી જરૂરી પાવતી અવી કામકાજના દિવસો દરમ્યાન મેળવી લેવી.